

જનસંપર્ક અધિકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૦૪/૨૦૧૭ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૧૧/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૮ કેસ કરી, ૨૮ વ્યક્તિઓને ઝડપી, ૩૫૬ લીટર દેશી દારૂ, ૨૮ બોટલ ઈંગ્લીશ દારૂ અને ૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૧,૩૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૮૧૨/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૬૯ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૨૮ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ:-

સમાચાર યાદી નં.૮૧૩/૧૭

સોલા હાઈકોર્ટ: હીનાબહેન રસમીકાંતભાઈ જોશી (રહે. રામબાગ આવાસ યોજના ઔડાના મકાન ચાંદલોડીયા) એ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૭/૪/૧૭ કલાક ૧/૦૦ થી સવારના ૬/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનો નકુચો તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૩૭,૦૦૦/- અને રોકડ રૂપિયા ૨૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬૨,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.આર.ભાયકન ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૮૧૪/૧૭

સરખેજ: પ્રતાપસિંહ બહાદુરસિંહ ગોહીલ (ઉ.વ.૫૮) (રહે.ગામ-કુકડ તાલુકો-ઘોઘા જીલ્લો-ભાવનગર) તા.૧૬/૪/૧૭ સાંજના ૬/૩૦ વાગ્યાના સુમારે ફીયાટ જેવી પેસેન્જર ગાડીમાં બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગાડીમાં બેઠેલ અજાણી ચાર વ્યક્તિઓએ ગાડીના ચાલકની મદદગારીથી પ્રતાપસિંહની નજર ચુકવી શેલામાંથી રોકડ રૂપિયા ૧,૦૨,૦૦૦/- કાઢી લઈ ગાડીના ટાયરમાં હવા ઓછી થઈ ગઈ છે એટલે હવા ભરાવવી પડશે તેમ કહી પ્રતાપસિંહને મકરબા દીવ્ય ભાસ્કર સામે ગાડીમાંથી ઉતારી નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ પ્રતાપસિંહે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.એસ.ઈસરાણી ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૮૧૫/૧૭

પાલડી: નિરાલીબહેન વા/ઓ ચંદનભાઈ ઠાકોર (રહે. ગુજરાત સોસાયટી સુવિધા શોપિંગ સેન્ટર પાછળ પાલડી) એ તા.૧૨/૪/૧૭ કલાક ૦૦/૩૦ વાગે રહેણાંક નજીક પોતાની વેગન આર કાર નંબર જીજે ૦૧ એચએલ ૮૧૭૩ કિંમત રૂપિયા ૧,૨૫,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી સવારના ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ નિરાલીબહેન ઠાકોરે તા.૧૭/૪/૧૭ નારોજ પાલડી પોલીસ સ્ટેશન ખાતે નોંધી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એમ.સિન્ધી ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૮૧૬/૧૭

જીઆઈડીસી વટવા: જીઆઈડીસી વટવા વિંઝોલ ગામ સામે વિનોબાભાવેનગર ખાતે તા.૧૪/૪/૧૭ સાંજના ૭/૦૦ વાગ્યાના સુમારે ઘરમાં ગેસનો બાટલો લિકેજ થતા ભડકો થતા ધનરાજસિંહ દુષ્યંતસિંહ રાહોડ (ઉ.વ.૮) આખા શરીરે દાજી જતા સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૭/૪/૧૭ કલાક ૧૧/૪૫ વાગે મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે જીઆઈડીસી વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી વી.એન વાઘેલા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૮૧૭/૧૭

રિવરફ્રન્ટ ઈસ્ટ: ભરતભાઈ દયારામભઈ વચેટા (ઉ.વ.૩૫) (રહે. અંબર કોલોની પ્રતિક શાર્કમાર્કેટ બાપુનગર) એ અગમ્ય કારણસર તા.૧૬/૪/૧૭ રાતના ૧૦/૦૦ વાગ્યા પહેલા સુભાષબ્રીજ સાબરમતી નદીમાં પડતું મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી પ્રવિણભાઈ અરખાભાઈ ચલાવે છે.

નરોડા: પીયુશભાઈ રમેશભાઈ વિરપરીયા (ઉ.વ.૨૭) (રહે. પાચલનગર ચત્રભુજ ડેરીની સામે નરોડા) એ બિમારીથી કંટાળી તા.૧૭/૪/૧૭ કલાક ૧૧/૩૦ થી ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી કેશાભાઈ ભુરાભાઈ ચલાવે છે.

અમરાઈવાડી: ચંદુજી કાળુજી ઠાકોર (ઉ.વ.૫૦) (રહે-લાલસિંગની ચાલી ચામુડાનગર અમરાઈવાડી) એ બિમારીથી કંટાળી તા.૧૭/૪/૧૭ કલાક ૧૧/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે અમરાઈવાડી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ગોમજીભાઈ લાલુભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.